



## નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ

પરિપત્ર નં. ૪૮ તા. ૨૨-૮-૧૯

ફક્ત ભુનિ. શાળાઓ માટે :-

**વિષય :-** ભુનિ. શાળાના બાળકોને લાવવા લઈ જવાના પરિવહનમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા બાબત.

**સંદર્ભ :-** કમાંક પ્રાશનિ/ખ-૨/૨૦૧૯/૭૩૬૪/૭૪૫૦ પ્રાથમિક શિક્ષણ નિયામકશીની કચેરીનો તા. ૧૯-૮-૨૦૧૯નો પત્ર

આથી તમામ ભુનિ. શાળાના મુખ્ય શિક્ષકશીઓને ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે શાળામાંથી બાળકોને લાવવા લઈ જવા વપરાતી સ્કૂલ બસ, સ્કૂલ વર્ધાની વાન કે કોઈપણ પ્રકારના સાધનમાં થતા પરિવહનમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાની આ સાથે સામેલ સંદર્ભિત પત્રમાં દર્શાવેલ જરૂરી સૂચનાઓનો ચિવટપૂર્વક અભ્યાસ કરી તેનું બિનચૂક પાલન કરવા જણાવવામાં આવે છે.

**બિડાણ :-** સંદર્ભિત પત્ર

તા. ૨૨-૮-૧૯

ડૉ. એલ. ડી. દેસાઈ  
શાસનાધિકારી

સ્કુલના બાળકોને લાવવા લઈ જવાના પરિવહનમાં  
માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા બાબત.

ક્રમાંક: /સીઓટી/MVP-રોડ સેફ્ટી/સ્કુલ સેફ્ટી/૨૦૧૯/ ૩૭૫૬

વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી, બ્લોક નં.-૬/૨,  
ડૉ. જીવરાજ મહેતા અવન, ગાંધીનગર, ગુજરાત રાજ્ય

તારીખ: ૧૨ JUN 2019

-: પરિપત્ર :-

### આમુખ:

શાળાથી બાળકોને લાવવા લઈ જવા વપરાતી સ્કુલ બસ તથા સ્કુલ વધીની વાનમાં થતા પરિવહનમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ આપવા વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી તથા શિક્ષણ વિભાગ દ્વારા વખતો વખત પરિપત્રો કરવામાં આવ્યા છે. આ પરિપત્રોની નકલો આ સાથે સામેલ છે. વધુમાં CBSC દ્વારા પણ બાળકોની સલામતી માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના અનુસંધાનમાં નીચે પ્રમાણે સંકલિત સૂચનાઓ આપવામાં આવે છે.

### સૂચનાઓ:

#### ૧. સ્કુલ બસ બાબતમાં સૂચનાઓ

##### ૧.૧ બસના બાહ્ય ભાગ અંગો:

- (એ) સ્કુલ બસને પીળો કલર કરેલ હોવો જોઈએ અને બસની બંને બાજુ સ્કુલનું નામ સ્પષ્ટ અને મોટા અક્ષરે લખેલું હોવું જોઈએ, જેથી સ્કુલ બસને ઓળખી શકાય.
- (બી) શાળાના બાળકોને લઈ જતી સ્કુલ બસની આગળ અને પાછળ 'સ્કુલ બસ' એવું સ્પષ્ટ અને મોટા અક્ષરે લખેલું હોવું જોઈએ જો બસ બાકે લીધેલ હોય/ભાડાની હોય તો, 'સ્કુલ વધી માટે' એવું સ્પષ્ટ લખેલું હોવું જોઈએ.
- (સી) ડ્રાઇવરની માહિતી(નામ, સરનામું, લાઈસન્સ નંબર, બેજ નંબર) અને શાળાનો કે બસ માલિકનો ટેલીફોન હેલ્પલાઇન નંબર અને રજીસ્ટ્રેશન નંબર, વાહનની અંદરની અને બાહ્યરની તરફ સ્પષ્ટ દેખાય એ રીતે કોન્ટ્રાસ્ટ રંગમાં લખેલ હોવા જોઈએ. તે બસમાં મુસાફર અને પદ્ધતીકને સ્પષ્ટ દેખાય એવી રીતે લખેલ હોવું જોઈએ કે જેથી જરૂરીયાતનાં સમયે સ્કુલ સત્તાવાળાઓ, પોલીસ કે અન્ય સત્તાધીકારીઓને માહિતગાર કરી શકાય.

##### ૧.૨ બસના આંતરિક ભાગ અંગો:

- (એ) બસની બારીઓ પર આડી પદ્દીઓ અને જાળી હોવી જોઈએ.
- (બી) બસના દરવાજા પર વિશ્વસનીય લોક હોવા જોઈએ.
- (સી) દરેક સ્કુલ બસમાં આપાતકાલીન સમયે બંધાર જવા માટેનો દરવાજો હોવો જ જોઈએ તે જવાબદારી સ્કુલ સત્તાવાળાઓએ સુનિશ્ચિત કરવાની રહેશે.
- (ડી) સ્કુલ બસમાં સ્પીડગવર્નર લગાવેલ હોવું જોઈએ કે જેની ગતિ મર્યાદા ૪૦ કી.મી. પ્રતિ કલાકની હોય.

(૯) દરેક સ્કુલ બસમાં ABC પ્રકારના ૫ કિલોની ક્ષમતાવાળા અને IDA પ્રમાણિત કરાયેલ હોય એવા બે અભિશામક હોય એ સ્કુલ સત્તાવાળાઓએ સુનિશ્ચિત કરવાનું રહેશે. જેમાંથી એક ડ્રાઇવર કેબીનમાં અને બીજું આપાતકાલીન દ્વાર પાસે રાખવું. જેના વપરાશ અંગેની તાલીમ ડ્રાઇવર, કંડકટર, એટેન્ડન્ટને આપેલ હોવી જોઈએ.

(એફ) સ્કુલના બાળકોની સાંબંધી માટે સ્કુલબસની બેઠકો બિન દહનશીલ પદાર્થમાંથી બનાવેલી હોવી જોઈએ.

(૩) GPS સીસ્ટમ અને CCTVની વ્યવસ્થા દરેક સ્કુલ બસમાં ફરજીયાત હોવા જોઈએ. બસનાં માલિક એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે લગાવેલ GPS અને CCTV હંમેશા કાર્યરત અવસ્થામાં જ રહે.

### ૧.૩ બસમાં સગવડ/સુવિધાઓ:

(એ) સ્કુલ બસમાં એક પ્રાથમિક સારવાર પેટી અને પીવાનું પાણી હોવું જોઈએ.

(બી) સ્કુલબેગને સલામત રાખવા/મુકવા માટે સીટની નીચે જગ્યા હોવી જોઈએ અથવા સ્કુલ બસની અંદર યોગ્ય જગ્યા હોવી જોઈએ.

(સી) સ્કુલ બસમાં એલાર્મ બેલ/ઘંટડી અને મોટા અવાજ વાળું એન્ઝિસંકેત સાધન હોવા જોઈએ કે જેથી આપત્તિ/કટોકટી ના સમયે દરેકને ચેતવણી આપી શકાય/ચેતવી શકાય.

(ડી) સ્કુલ બસમાં પડાં લગાવવા નહિ તેમજ કાચ પર ડિલ્બ લગાડવી નહિ.

(ઇ) સ્કુલ બસમાં અંદર પુરતું અજવાળું હોવું જોઈએ.

(એફ) સ્કુલ બસ જયારે રોડ પર જતી હોય ત્યારે અંદર થતી પ્રવૃત્તિઓ બહારથી દ્રશ્યમાન હોવી જોઈએ.

### ૧.૪ બસમાં બાળકોની સલામતી માટે મહત્વની સૂચનાઓ:

(એ) માન્યતા પ્રાપ્ત સ્કુલોએ રાજ્ય વાહનવ્યવહાર વિભાગ દ્વારા સુચિત કરેલ માન્ય મંજુરી ન ધરાવતી તેમજ આવશ્યક શરતોનું પાલન ન કરતી બસ પછી તે, ભાડેથી લીધી હોય કે પોતાની માલીકીની બસ હોય, તેનો બાળકોને લાવવા લઇ જવા માટે ઉપયોગ ન કરવો..

(બી) મોટર વીકલ એક્ટ - ૧૯૮૮ પ્રમાણે સ્કુલબસ અને સ્કુલબસનાં મુસાફરોનો માન્ય વીમો, ટેક્ષ, પરમીટ, પીયુસી, ફીટનેશ હોવો જોઈએ. ડ્રાઇવર પાસે અધિકૃત ડ્રાઇવરની લાયસન્સ હોવું જોઈએ.

(સી) દર વર્ષે ડ્રાઇવરની શારીરિક તપાસ અને આંખોની તપાસ થવી જોઈએ અને અધિકૃત સત્તાધીશ પાસેથી મોટર વીકલ એક્ટ - ૧૯૮૮માં જણાવ્યા પ્રમાણેનું "શારીરિક યોગ્યતા અંગેનું પ્રમાણપત્ર" મેળવેલ હોવું જોઈએ.

(ડી) લાલ બાતી/રેડ સિઝલની અવગાણના કરવી, તેન ડ્રાઇવરની શિસ્તલંગ કે અનધિકૃત વ્યક્તિને વાહન ચલાવવા આપવું વગેરે જેવા ડ્રાઇક ગુનાઓમાં બે થી વધુ વખત સંડોવાયેલ હોય તેવા ડ્રાઇવરને કર્મચારી તરીકે સ્કુલ સત્તાવાળાઓ રાખી શકશે નહીં.

(ઇ) ખુબ જ ઝડપી તેમજ ખતરનાક રીતે વાહન ચલાવવા માટે અથવા ઇન્ડિયન પિનલ કોડની કલમ - ૨૭૬, ૩૩૭, ૩૩૮, ૩૦૪એ અથવા POSCO(પોસ્કો) એક્ટ - ૨૦૧૨ હેઠળ અથવા અન્ય કોઈ ફોજદારી કાયદા હેઠળ ગુનાહિત ઠરેલ હોય, તેવા ડ્રાઇવરને સ્કુલ સત્તાવાળાઓ કર્મચારી તરીકે રાખી શકશે નહીં.

- (એક) વાહનવ્યવહાર વિભાગ દ્વારા આપવામાં આવેલ માન્ય "જાહેર સેવા માટેનાં વાહન ચલાવવા અંગેનો ફોટોવાળો બેજ" હોય તેવા ડ્રાઇવરે જ વાહન ચલાવવું જોઈએ.
- (દુષ્ટ) ગુજરાત મોટર વીકલ્સ રૂલ્સ, ૧૯૮૮ ના નિયમ ૧૧૬ મુજબ જો વિદ્યાર્થીની ઉંમર ૧૨ વર્ષથી ઓછી હોય તો, માન્યતા પ્રાપ્ત બેઠક ક્ષમતાના બમણાથી વધારે વિદ્યાર્થીઓનું વહન કરવું નહીં/બેસાડવા નહીં.
- (એચ) મોટર વીકલ એક્ટ - ૧૯૮૮ મુજબ "સ્ક્રુલબસની રોડ પર ચલાવવા માટેની યોગ્યતા" હોય તેવું સ્ક્રુલબસની યોગ્યતા અંગેનું પ્રમાણપત્ર (ઝીટનેશા) સમયાંતરે મેળવવાનું રહેશે.
- (આઈ) કોઈપણ સ્ક્રુલ સત્તાધારી અને/અથવા સ્ક્રુલબસ ડ્રાઇવર મોટર વીકલ એક્ટ - ૧૯૮૮ અને તેમાં સમાવિષ્ટ નિયમો ઉપરાંત, બોડ્ડ, રાજ્ય સરકાર અને કોર્ટની સુચનોનું ઉલ્લંઘન કરતાં મળશે તો કાયદાકીય પગલા ને પાત્ર રહેશે.
- (જે) જ્યાં સ્ક્રુલબસ ભાડે લેવામાં આવી હોય તો, સ્ક્રુલ સત્તાધિકારીઓએ માલીક સાથે માન્ય કરાર કરવો અને આ કરારની નકલ સ્ક્રુલબસ ચલાવતા ડ્રાઇવર સાથે રાખવી.
- (કે) વિદ્યાર્થીઓના નામ, ધોરણ, રહેઠાણનું સરનામું, બ્લડ ગ્રુપ, બસમાં ઉભા રહેવાના સ્થળો, માર્ગ ચોજના(રૂટ પ્લાન)ની માહિંતી/વિગતો ધરાવતું રેકડ હંમેશા સ્ક્રુલબસ કંડક્ટર પાસે સ્ક્રુલબસમાં તૈયાર રાખવું જોઈએ.
- (એલ) જ્યારે પણ સ્ક્રુલના બાળકોનું પરિવહન કરારથી કરવામાં આવતું હોય ત્યારે, વાહનના માલિકે આ અંગેની જાણ ડ્રાઇવરના નામ અને વાહનની વિગત સાથે ક્ષેત્રિય પોલીસ સ્ટેશન, અને જિલ્લા ટ્રાફિક પોલીસને સ્પષ્ટ જણાવવાની રહેશે.
- (એમ) સ્ક્રુલબસ ચલાવતી વખતે ડ્રાઇવર મોબાઇલ ફોનનો વપરાશ કરી શકશે નહીં અને વિદ્યાર્થી તેમજ સ્ટાફ સાથે વધારેન્પડતી કિયાપ્રતિકિયા / વાર્તાલાપ કરી શકશે નહીં.
- (એન) સ્ક્રુલબસ ચાલતી હોય ત્યારે રેના દરવાજા બંધ રહે એ સ્ક્રુલ સત્તાવાળાઓએ સુનિશ્ચિત કરવાનું રહેશે.
- (ઓ) સ્ક્રુલબસમાંથી જ્યારે સ્ક્રુલના બાળકો ચઢતાં અને ઉત્તરતાં હોય ત્યારે, સ્ક્રુલબસ સ્થિર હાલતમાં હોવી જોઈએ.
- (્પી) ડ્રાઇવરની ડ્રાઇવિંગ કુશળતામાં વધારો થાય તે માટે સમયાંતરે રિફેસર તાલીમ આપવી. (દા.ત. વર્ષમાં બે વાર)
- (ક્યું) નશાની હાલતમાં ડ્રાઇવર સ્ક્રુલબસ ચલાવી શકશે નહીં. આ બાબતે નિયમિતપણે તપાસ સ્ક્રુલ સત્તાધીશોએ કરવી. જો કોઈ વાંધાજનક જણાય તો, સ્ક્રુલબસના ડ્રાઇવરની તબીબી તપાસ થંબી જોઈએ અને જરૂર લાગે ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લેવા જોઈએ.
- (આર) સ્ક્રુલ સત્તાધીશોએ દરેક સ્ક્રુલ બસમાં એક મોબાઇલ ફોન પુરો પાડવો કે જેથી આપત્તિના સમયે સ્ક્રુલબસનો સંપર્ક થઈ શકે અથવા ડ્રાઇવર કે કંડક્ટર પોલીસ, રાજ્ય સત્તાધીશો અને સ્ક્રુલ સત્તાધીશોનો સંપર્ક કરી શકે.
- (એસં) સ્ક્રુલબસ જ્યારે સ્ક્રુલના બાળકોને લઈ જઈ રહી હોય ત્યારે આ બસ અન્ય વાહનોને ઓફરટેક ના કરે તે સ્ક્રુલ સત્તાવાળાઓએ સુનિશ્ચિત કરવાનું રહેશે.
- (ટી) માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા નિયમિત સમયાંતરે રોડ સેફ્ટી મેળા, ટીમ પ્રોજેક્ટના કાર્યક્રમો, રોડ સેફ્ટી કલબનું આયોજન થતું રહે તે ઇચ્છનીય છે. વધુમાં સ્ક્રુલ સત્તાધીશોએ વિદ્યાર્થીઓનાં માર્ગ

સલામતી સપ્તાહ દરમયાન નાટક અને પ્રદર્શન જેવા આયોજન કરે અને જહેર જનતામાં જાગૃતિ લાવે તે માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

- (૩૬) માતા-પિતા કે વાતી બાળકોને શાળાએ લાવવા લઇ જવા ટ્રાન્સપોર્ટ વર્ગ (પીળી નંબર પ્લેટ) માં નોંધાયેલા વેલીડ પરમીટ થર્ડપાર્ટી તથા બાળકોનો વેલીડ વીમો, વેલીડ પી.યુ.સી., વેલીડ ફીટનેશ સર્ટી. ધરાવતા અને અધિકૃત ડ્રાઇવીંગ લાયસન્સ ધરાવતા ડ્રાઇવર દ્વારા હંકારતા વાહનનો જ ઉપયોગ કરવો.

ઝૂલબસ ભાડે લેવામાં આવી હોય તો પણ આ સૂચનાઓ વાહનના ઓપરેટરને તેમજ સ્કુલ સત્તાવાળાઓને સરળી રીતે લાગુ પડશે. આ સૂચનાઓનું પાલન નહિ થયાનું ધ્યાનમાં આવશે તો બસની પરમીટ મોટર વ્હીકલ્સ એક્ટ, ૧૯૮૮ની કલમ-૮૬ અનુસાર સસેન્ડ અથવા રદ કરવા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. જેની સ્પષ્ટ નોંધ લેવી

## ૨. સ્કુલ વધી માટે વપરાતી ઓટો રીક્ષા, વાન વગેરે માટે સૂચનાઓ

મોટાખાગના વાલીઓ પોતાના બાળકોને શાળાએ લઇ જવા- લાવવા માટે ખાનગી માલિકની ઓટોરીક્ષા, વાન વગેરેની સેવા ભાડેથી મેળવતા હોય છે. જે અન્વયે બાળકોની સલામતી માટે અત્રેથી વખતો વખત જરૂરી પરિપત્રો કરવામાં આવ્યા છે. આ રીતે થતા પરિવહનમાં બાળકોની સલામતી જળવાય તે રીતે પરિવહન કરવા નામદાર ગુજરાત હાઇકોર્ટ પણ અલગ અલગ કેસોમાં વિવિધ દિશાનિર્દેશો આપેલા છે. આ તમામના અનુસંધાને નીચે પ્રમાણે સંકલિત સૂચનાઓ આપવામાં આવે છે.

- (૩૭) શાળાના બાળકોને ઘેરથી શાળાએ લઇ જવા અને પરત લાવવા માટે થી વ્હીલર પેસેન્જર ઓટોરીક્ષાઓ સાથે મારુતિ વાન વિગેરે જેવા વાહનોનો-મોટાખાએ ઉપયોગ થાય છે. આ વાહનો બેઠક ક્ષમતાની દ્રષ્ટિએ બે પ્રકારના હોય છે.

(૧) ૫+૧ સુધીની બેઠક ક્ષમતા ધરાવતા વાહનો.

(૨) ૬ થી વધારે પરંતુ ૧૨ મુસાફરો સુધી (ડ્રાઇવર સિવાય) બેઠક ક્ષમતા ધરાવતા વાહનો.

ગુજરાત મોટર વ્હીકલ્સ રૂલ્સ, ૧૯૮૮ના નિયમ: ૧૧૮(૧) મુજબ સ્કુલના ઉપયોગ માટેના પબ્લિક સવિસ વ્હીકલ્સમાં બાર વર્ષની ઉંમર કરતા વધારે ન હોય તેવું બાળક "અડધા" તરીકે ગણાય છે. આમ, આ પ્રકારના વાહનોમાં તેની નિયત થયેલ બેઠક ક્ષમતા કરતા બમણી સંખ્યામાં ૧૨ વર્ષ સુધીની ઉંમરના બાળકોને સ્કુલના હેતુ માટે લાવી, લઇ જઈ શકાય.

બાળકોને ઘેરથી શાળાએ અને શાળાએથી ઘેર પરત લાવવા માટે વપરાતા ઓટોરીક્ષા તથા મારુતિ વાન જેવા વાહનોમાં જરૂરી પરમીટ આપતા પહેલા સક્ષમ ઓથોરીટીએ તે વાહનના ઉત્પાદકે નિયત કરેલ બેઠક ક્ષમતાના બમણાથી વધારે ન હોય તેટલી મર્યાદામાં બાળકો સમાવવા માટે પરવાનગી આપવી અને જો ચેકિંગ વખતે આવા વાહનોમાં તેના ઉત્પાદક નિયત કરેલ બેઠક ક્ષમતાના બમણાથી વધારે ૧૨ વર્ષ સુધીના બાળકો બેસાડેલા ધ્યાનમાં આવેતો, આવા વાહન અંગે પરમીટ શરતોના લંગ બદલનીકાયદેસરની કાર્યવાહી કરવી.

- (૩૮) મોટર વ્હીકલ એક્ટ - ૧૯૮૮ પ્રમાણે સ્કુલ વધીનું વાહન અને તેમાં લાવવા લઇ જવાના વિદ્યાર્થીઓનો માન્ય વામો, ટેક્ષ, પરમીટ, પી.યુ.સી., ફીટનેશ હોવો જોઈએ. ડ્રાઇવર પાસે અધિકૃત

ડ્રાઇવીંગ લાયસન્સ હોવુ જોઈએ સ્કુલના બાળકોને ભાડેથી લઈ જવા દરેક વાહનની આગળ - પાછળ સ્કુલ રીક્ષા, સ્કુલ વાન એમ વચ્ચાપુસ્તંગ સ્પૃષ્ટ અને મોટા અક્ષરે અવશ્ય લખવું જોઈએ.


- (સી) જો આ વાહન બાળકો માટે ભાડેથી ફરતું હોય તો તેની પર સ્કુલવધી એમં સ્પૃષ્ટ દેખાય તે પ્રમાણે લખવું જોઈએ.
- (ડી) દરેક વાહનમાં પ્રાથમિક સારવારની પેટી બિનયૂક ફરજીયાત રાખવી જોઈએ.
- (ઈ) દરેક વાહનમાં જરૂરી અભિશામક સાંધનો ફરજીયાત રાખવા જોઈએ.
- (એફ) આવા વાહન ઉપર તેના માલિકનું નામ અને ટેલીફોન નંબર અવશ્ય લખેલા હોવા જોઈએ.
- (જી) સ્કુલવાનના બારણાસારી ગુણવત્તાવાળા તાળાઓથી બંધ કરવા જોઈએ.
- (એચ) દરેક વાનમાં સ્કુલ બેગ સલામત રાખવા માટે જરૂરી જગ્યા રાખવી જોઈએ.
- (આઈ) ઓટોરીક્ષામાં તથા વાનમાં ઉતારું કમ્પાઈનેન્ટવધારાની બેઠક વ્યવસ્થા કરવાની રહેશે.
- (જૈ) સીટ કુશન સાદી સપાટીવાળું હોવું જોઈએ, વાંકીચુકી સપાટીવાળું હોવું જોઈએ નહિ.
- (કે) વાનમાં ઉતારું કમ્પાઈનેન્ટમાં બારીઓએવી ડીઝાઇનવાળી જાળીથી કાચમી રીતે બંધ કરવી જોઈએ કે જેથી જાળીમાંથી બાળકોનો કોઈ અવયવ બહાર આવી શકે નહિ.
- (એલ) વાહનમાં બલ્બ હોર્ન બેસાડેલ હોવું જોઈએ. અને આવું હોર્ન હંમેશા ચાલુ હાલતમાં હોવું જોઈએ.
- (એમ) આવું વાહન કલાકમાં ૨૦કી.મી. કરતા વધુ અડપે ચલાવી શકાશે નહિ.
- (એન) વાહનમાં બાળકોના દફ્તર ડાબી તથા જમણી બાજુએ બહાર લટકાવી શકાશે નહિ.
- (એઓ) વાહન ઉપર આગળની બાજુએ, ડાબી બાજુએ, જમણી બાજુએ તથા પાછળના ભાગમાં પીળા બેકગ્રાઉન્ડ ઉપર લાલ રંગમાં સ્કુલ વાન શાબ્દ ચિત્રરવાના રહેશે.
- (પી) ડ્રાઇવરની સીટ ઉપર કોઈપણ બાળકને બેસાડી શકાશે નહિ.
- (ક્ર્યુ) ગુજરાત મોટર વીકલ્સ રૂલ્સ, ૧૯૮૮ ના નિયમ ૧૧૬ મુજબ સ્કુલવધીના વાહનોમાં ૧૨ વર્ષ સુધીના બાળકો માટે ૧ સીટ દીઠ બે બાળક બેસી શકે તેવી કાચદાકીય જોગવાઈ છે. આનાથી વધારે બાળકો બેસાડી બાળકોનું પરિવહન કરતા વાહનો સામે કડક ચેકિંગ કરવું.
- (આર) ખાનગી રજીસ્ટ્રેશન (પાસીંગ) ધરાવતા વાહનોમાં ભાડેથી બાળકોને લાવવા અને લઈ જવા એ મોટર વીકલ્સ એક્ટ, ૧૯૮૮ની કલમ-૩૮ અને ૧૯૨એ હેઠળનો ગંભીર ગુણ્ણો છે અને આવું વાહન કલમ ૨૦૭ નીચે ડીટેઇન થઈ શકે છે. તેથી આવા વાહનો ડીટેઇન કરી તેમનું રજીસ્ટ્રેશન રદ મોટર વીકલ્સ એક્ટ, ૧૯૮૮ની કલમ-૫૮ અનુસાર સસ્પેન્ડ કરવા પગલા લેવા.
- (એસ) સ્કુલવધીના વાહનોમાં કોઈપણ મંજુરી લીધા વગર CNG અથંવા LPG ગેસ પર નાહન ચલાવવું ગંભીર ગુણ્ણો છે. કેટલાક કિસ્સામાં ડોમેસ્ટિક વપરાશમાં LPG નારા વાહન ચલાવવાનું હોવાની પણ શક્યતા હોય છે. આ બહુજ ગંભીર બાબત છે. તેથી આવા વાહનો ચેકિંગ કરી તેની અંદરની ગેરકાચદેસર કીટ/બાટલો કાઢીને કડક કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.
- (ટી) સ્કુલવધી વાનના ડ્રાઇવર પણે ડ્રાન્સપોર્ટ વાહન ચલાવવાનો બેઝ ફરજીયાત પણે હોવો જોઈએ. આવા કિસ્સામાં કલમ-૨૦૭ હેઠળ વાહન ડીટેઇન થઈ શકે છે. આવા વાહનોનું કડક ચેકિંગ કરી ડીટેઇન કરવા.

(યુ) સ્કુલવધી વાન થર્ડ પાર્ટી વીમા વગર વપરાતી હોવાનું ધ્યાનમાં આવે તો ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટી એક્ટ, ૨૦૧૮ની કલમ-૧૪(૧) હેઠળ વાહન ડિટેઇન કરવું. તથા આ કાયદા અને મોટર વીકલ્સ એક્ટ, ૧૯૮૮ની જોગવાઈઓ હેઠળ ૫૫૫ પગલા લેવા.

ઉક્ત સુચનાઓનું યુસ્ત રીતે પાલન થાય તે સુનિશ્ચિત કરવા રોજગરોજના નિયમિત રેકૉર્ડમાં આ તમામ મુદ્દાઓનો સમાવેશ કરવો.


તમામ પોલીસ કમિશનરશીઓ અને ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટશીઓ કે જે હોદાની રૂએ અનુકૂમે સીટી અને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીના અધ્યક્ષ છે, તેઓને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટી એક્ટ, ૨૦૧૮ ની કલમ - ૧૫(૧) હેઠળ મળેલી સત્તાની રૂએ આ પરિપત્રોની અમલવારી કરાવવા સીટી અને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠકોમાં જરૂરી ઠરાવ પસાર કરી બહોળી પ્રસિદ્ધિ કરી અમલવારી સુનિશ્ચિત કરવા જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવે છે.

વિડાએ:- ઉપર મુજબ

  
વાહન વ્યવહાર કમિશનર  
ગુજરાત રાજ્ય, ગાંધીનગર.

ક્રમાંક પ્રાણિનિ/ખ.ર/૨૦૧૮/ ૭૩૬૪/૭૪૫૦  
પ્રાથમિક શિક્ષણ નિયામકની સ્થાની,  
બ્લોક નં.૧૨/૧, ડો.જીવરાજ મહેતા ભવન,  
ગુ.રા. ગાંધીનગર તા. ૧૬/૦૭/૨૦૧૮

ઉક્ત તા.૧૨/૦૬/૨૦૧૮ ના પરિપત્રમાં સુચવ્યા મુજબની જરૂરી કાર્યવાહી તથા અમલવારી કરાવા સારુ . . .

  
(ડૉ. એમ.આઠ.જોડી)  
નિયામક પ્રાથમિક શિક્ષણ  
ગુ.રા.ગાંધીનગર

પ્રતિ,

- છિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ
- છિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ
- શાસનાધિકારીશ્રી, તમામ